

## હિસાબ નિયામકશ્રીની કચેરી

## આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ

પરીપત્ર ક્રમાંક હિનિ/પે-સેલ/૨૩૦-૩૧/૨૦૨૦

તા. ૧૬-૧૨-૨૦૨૦

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેના તમામ ઉપાડ અને ચુકવણા અધિકારીઓને જણાવવાનું કે, આપશ્રીની કચેરી ખાતે દ્વચ બજાવતા જે કર્મચારીઓ/ અધિકારીશ્રીઓની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓએ તેમની આવક તેમજ બચત/ રોકાણની વિગતો આ સાથે સામેલ રાખેલ આવકવેરાના ફોર્મમાં રજુ કરવાની રહે છે. આ આવકવેરાના ફોર્મ ભરીને જરૂરી **આધાર પુરાવા** સાથે સામેલ રાખી આપશ્રીની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી કર્મચારીના પોતાના PAN નંબર(Correct) સહિત **તા.૧૮/૦૨/૨૦૨૧ સુધીમાં** અત્રેની કચેરીના પે એન્ડ પેન્શન સેલને **બે (૨) નકલમાં** મોકલી આપવાના રહેશે.

આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ (નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧) ના આવકવેરાની ગણતરી માટે નીચે મુજબના બે વિકલ્પ આપવામાં આવેલ છે.

જે અન્વયે કર્મચારી/ અધિકારીશ્રીએ પોતાના આવક-વેરાના ફોર્મમાં “ હું વિકલ્પ-“A”-(નવો વિકલ્પ) અથવા વિકલ્પ-“B”-(જુનો વિકલ્પ) સ્વીકારવા સમંત છું તેમ સ્પષ્ટપણે જણાવવાનું રહેશે”. જે નવો વિકલ્પ-“A” સ્વીકારવો હોય તો બચત બતાવવાની નથી અને કોઇપણ આધાર પુરાવા સામેલ રાખવાની જરૂરીયાત નથી. પરંતુ જે જુનો વિકલ્પ-“B” સ્વીકારવો હોય તો બચતના તમામ આધાર/પુરાવા બે નકલમાં ફોર્મ સાથે સામેલ રાખીને **તા.૧૮/૦૨/૨૦૨૧ સુધીમાં** આ કચેરીને મોકલી આપવાના રહેશે.

વિકલ્પ-“A”- (નવો વિકલ્પ)	વિકલ્પ-“B”- (જુનો વિકલ્પ)																										
<ul style="list-style-type: none"> <li>કોઇપણ મુક્તિ અથવા કપાત વિના આવક ધ્યાને લઇને નીચેના દરે આવકવેરાની ગણતરી (U/s 15BAC)</li> </ul> <table border="1"> <tr> <th>કુલ આવક</th><th>વેરાનો દર</th></tr> <tr> <td>૨,૫૦,૦૦૦ સુધી</td><td>શૂન્ય</td></tr> <tr> <td>૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦</td><td>૫ %</td></tr> <tr> <td>૫,૦૦,૦૦૧ થી ૭,૫૦,૦૦૦</td><td>૧૦ %</td></tr> <tr> <td>૭,૫૦,૦૦૧ થી ૧૦,૦૦,૦૦૦</td><td>૧૫%</td></tr> <tr> <td>૧૦,૦૦,૦૦૧ થી ૧૨,૫૦,૦૦૦</td><td>૨૦ %</td></tr> <tr> <td>૧૨,૫૦,૦૦૧ થી ૧૫,૦૦,૦૦૦</td><td>૨૫%</td></tr> <tr> <td>૧૫,૦૦,૦૦ થી વધુ</td><td>૩૦ %</td></tr> </table>	કુલ આવક	વેરાનો દર	૨,૫૦,૦૦૦ સુધી	શૂન્ય	૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦	૫ %	૫,૦૦,૦૦૧ થી ૭,૫૦,૦૦૦	૧૦ %	૭,૫૦,૦૦૧ થી ૧૦,૦૦,૦૦૦	૧૫%	૧૦,૦૦,૦૦૧ થી ૧૨,૫૦,૦૦૦	૨૦ %	૧૨,૫૦,૦૦૧ થી ૧૫,૦૦,૦૦૦	૨૫%	૧૫,૦૦,૦૦ થી વધુ	૩૦ %	<ul style="list-style-type: none"> <li>મુક્તિ અથવા કપાતને બાદ કરીને આવક ધ્યાને લઇને નીચેના દરે આવકવેરાની ગણતરી</li> </ul> <table border="1"> <tr> <th>કુલ આવક</th><th>વેરાનો દર</th></tr> <tr> <td>૨,૫૦,૦૦૦ સુધી</td><td>શૂન્ય</td></tr> <tr> <td>૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦</td><td>૫ %</td></tr> <tr> <td>૫,૦૦,૦૦૧ થી ૧૦, ૦૦,૦૦૦</td><td>૨૦ %</td></tr> <tr> <td>૧૦,૦૦,૦૦ થી વધુ</td><td>૩૦ %</td></tr> </table>	કુલ આવક	વેરાનો દર	૨,૫૦,૦૦૦ સુધી	શૂન્ય	૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦	૫ %	૫,૦૦,૦૦૧ થી ૧૦, ૦૦,૦૦૦	૨૦ %	૧૦,૦૦,૦૦ થી વધુ	૩૦ %
કુલ આવક	વેરાનો દર																										
૨,૫૦,૦૦૦ સુધી	શૂન્ય																										
૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦	૫ %																										
૫,૦૦,૦૦૧ થી ૭,૫૦,૦૦૦	૧૦ %																										
૭,૫૦,૦૦૧ થી ૧૦,૦૦,૦૦૦	૧૫%																										
૧૦,૦૦,૦૦૧ થી ૧૨,૫૦,૦૦૦	૨૦ %																										
૧૨,૫૦,૦૦૧ થી ૧૫,૦૦,૦૦૦	૨૫%																										
૧૫,૦૦,૦૦ થી વધુ	૩૦ %																										
કુલ આવક	વેરાનો દર																										
૨,૫૦,૦૦૦ સુધી	શૂન્ય																										
૨,૫૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦	૫ %																										
૫,૦૦,૦૦૧ થી ૧૦, ૦૦,૦૦૦	૨૦ %																										
૧૦,૦૦,૦૦ થી વધુ	૩૦ %																										

- આ સાથેના નમૂના મુજબનું Self- Assessment Statement ઉક્ત તારીખ સુધીમાં નહીં મળે તો તેઓની આવકની ગણતરી કરી લઇ તેઓએ કોઇ બચત/ રોકાણ કરેલ નથી તેમ માની લઇને કપાત કરવા પાત્ર આવકવેરા માટે ફેબ્રુઆરી-૨૦૨૧ ના બીલમાં કપાત કરી દેવામાં આવશે.
- કર્મચારીઓ/ અધિકારીઓએ Self - Assessment Statement માં દર્શાવ્યા મુજબની બચત/રોકાણ અચૂકપણેસાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કરવાનું રહેશે. જે તેમ કરવામાં તેઓ કસુર કરશે તો તેઓનો અંગત જવાબદારી રહેશે.
- કર્મચારી/ અધિકારી દ્વારા બચત/ રોકાણમાં ફેરફારને કારણે વધારાનો આવકવેરા કપાત કરવાનો થતો હશે તો તે માટે ફેબ્રુઆરી-૨૦૨૧ ના બીલમાં કપાત કરી દેવામાં આવશે.

- જે કર્મચારીઓ ઇન્કમ ટેક્સ PAN ધરાવે છે તેમજ નિયમિત રીતે રીટર્ન ફાઇલ કરે છે તેવા તેમજ જેઓની કુલ આવક રૂ.૫૦,૦૦૦/- કે તેથી વધુ હોય તેવા કર્મચારીઓએ ફોર્મ નં.૧૬ મેળવવા માટે તેઓનું Self-Assessment Statement પે-સેલને નિયત સમય મર્યાદામાં અચૂક મોકલી આપવાનું રહેશે. જે કર્મચારીઓના Self-Assessment Statement અત્રે નહીં મળેલ હોય તેવા કર્મચારીઓ ફોર્મ નં.૧૬ મેળવવા હકકદાર રહેશે નહીં.
- અત્રેની કચેરીના ધ્યાન ઉપર એવું પણ આવેલ છે કે કેટલાક કર્મચારી/ અધિકારીશ્રીઓ બચત/ રોકાણ કરશે તેમ જણાવે છે પરંતુ હકીકતમાં તેઓ ધવારા આવું રોકાણ કરવામાં આવતું નથી જે ઘણી જ ગંભીર બાબત છે. આ કારણોસર કપાત કરવાપાત્ર થતા આવકવેરાની કપાત નહીં થવાથી ઉપાડ અને ચુકવણા અધિકારી તો જવાબદાર ઠરે છે પરંતુ સાથોસાથ સંબંધિત અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ પણ આડકતરી રીતે જવાબદાર ગણાય છે.  
ઉપરના સંબંધોમાં ઉપરિલિખિત ના થાય અને આવકવેરા વિભાગની કારણદર્શક નોટીસનો સામનો ન કરવો પડે તે માટે જે તે કર્મચારીઓ/ અધિકારીશ્રીઓએ તેમની બચત/રોકાણના પુરાવા તા.૧૮/૦૨/૨૦૨૧ સુધીમાં અત્રેના પે-સેલ સમક્ષ અચૂક રજૂ કરવાના રહેશે અન્યથા તેઓએ બચત કે રોકાણ કરેલ નથી તેમ માની લઇ કપાત કરવાપાત્ર થતો આવકવેરો માટે ફેબ્રુઆરી-૨૦૨૧ ના પગારમાંથી કપાત કરી લેવામાં આવશે.
- જે કર્મચારીઓ / અધિકારીશ્રીઓની કુલ ગ્રોસ આવક રૂ.૫૦,૦૦૦/- કે તેથી વધુ હોય (૫૦,૦૦૦- Standard Deduction તથા Chapter IV-A of Income Tax Act-1961 હેઠળની કપાત બાદ કર્યા સિવાય) તેઓએ આવકવેરાનું પત્રક અચૂકપણે ભરીને અત્રે મોકલી આપવાનું રહેશે.
- વધુમાં જે કર્મચારીઓ/ અધિકારીશ્રીઓએ Permanent Account Number (PAN) મેળવ્યો ન હોય તેઓએ તાત્કાલિક (PAN) મેળવી લેવાના રહેશે અને તેનો પૂરાવો લેખિતમાં સંબંધિત કચેરીમાં રજૂ કરવાનો રહેશે. ઉપરાંત જે કર્મચારીઓ/ અધિકારીશ્રીઓએ PAN મેળવ્યો છે તેઓએ તેઓના PAN CARD ની ઝેરોક્ષ નકલ સંબંધિત કચેરી ખાતે તાત્કાલિક આપવાની રહેશે અન્યથા તેઓને ફોર્મ નં. ૧૬ આપવામાં આવશે નહીં.
- માટે ડિસેમ્બર-૨૦૨૦ માં જે કોઈ કર્મચારી/ અધિકારીને આવકવેરા કપાતમાં સુધારો કરવાનો થતો હોય તો પગાર ચેન્જસમાં દર્શાવવાનો રહેશે અને જે ચેન્જસમાં દર્શાવવામાં નહીં આવે તો માટે નવેમ્બર-૨૦૨૦ ના પગારબીલમાં જે કપાત થયેલ હશે તે મુજબ જ આવકવેરાની કપાત ચાલુ રહેશે.

  
ઓડીટ ઓફીસર

પે એન્ડ પેન્શન સેલ

**નકલ રવાના :**

- (૧) હિસાબી અધિકારીશ્રી (પી.એફ/ પેન્શન), આણંદ ટ્રસ્ટિ યુનિવર્સિટી, આણંદ તરફ જાણ સારું.
- (૨) આણંદ ટ્રસ્ટિ યુનિવર્સિટી હસ્તકની તમામ કચેરીઓના ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રી તરફ જાણ અને અમલ થવા સારું.

**PAY & PENSION CELL**  
**ANAND AGRICULTURAL UNIVERSITY, ANAND**  
**Self Assessment of Income-Tax for the Financial Year 2020-21**  
**Assessment Year : 2021-22**

EMP NO		Birth Date		PAN NO												
NAME											DESIGNATION					
Mobile No.																

Sr.No	Particulars	Amount	
1	<b>Gross Salary</b>		
	NSC Interest re- invested		
	NPS (Governments's Share)		
	Medical Reimburse		
	Honorarium		
	Any Other		
	Recovery ( Only Salary) <span style="float: right;">(-)</span>		
	<b>Gross Total Income</b>		
2	<b>Less :-</b>		
	(a) Standard Deduction U/s16(ia) (Maxi. Rs.50000/-)		
	(b) Professional Tax U/s 16 (i)		
	(c) C M FUND		
3	<b>Balance (1-2)</b>		
4	<b>Less :-</b> HBA Interest U/s 24B (i) (iv) Upto Rs.30,000/- Prir to Dt. 01/04/1999 Upto Rs.2,00,000/- On or after Dt. 01/04/1999		
5	<b>Total Income (3-4)</b>		
6	<b>Deduction : Under Chapter VI-A</b>		
		<b>Gross Rs.</b>	<b>Qualifying Rs.</b>
	a) Mediclaim U/s 80-D (Max.25,000)		
	b) Medical Treatment of Handicapped dependents U/s 80-DD (Max.75,000)		
	c) Medical Treatment on Serious disease U/s 80-DD B (Max.40,000)		
	d) Pemanent Disability U/s 80-U (Max.75,000)		
	e) Education Loan Interest U/s 80-E		
7	<b>Total (a to e)</b>		
8	<b>Gross Total Income (5-7)</b>		
9	<b>Deduction : U/s 80 C &amp; 80 CCD</b> (Max. 1,50,000)	<b>Gross Rs.</b>	<b>Qualifying Rs.</b>
	<b>9A U/s 80 C</b>		
	(i) GPF Contribution		
	(ii) GSLI		
	(iii) PPF		
	(iv) LIC Premiun		
	(v) PLI Premiun		

**P.T.O.**

	<b>9A U/s 80C (cont.....)</b>			
	(vi) Deposits in 10 Year, 15 Year account under the P.O. Saving Bond (CTD)			
	(vii) NSC			
	(viii) NSC Interest re- Invested			
	(ix) ULIP/ Equity Link Saving Fund			
	(x) Investment in Pension Fund			
	(xi) HBA Repayment of Principal			
	(xiii) Education Expenses (Tuition/ Education Fee Only Up to 2 Children)			
	(xiv) Any other			
	<b>Total (9A) Max. 1,50,000</b>			
	<b>9B U/s 80 CCD (1 B)</b>			
	NPS (Employee's Share)			
	NPS (Government's Share)			
	<b>Total (9B) Additional Deduction Max. 50,000</b>			
10	<b>Total (9A &amp; 9B) Qua. Amt. Max. 2,00,000</b>			
11	<b>Net Taxable Total Income (8-10)</b>			
12	LESS :- TOTAL TAXABLE INCOME NOT EXCEEDING RS. 5,00,000 THE AMOUNT OF REBATE IS RS.12,500/- OR THE AMOUNT OF TAX PAYABLE WHICH EVER IS LOWER			
13	Net Taxable Total Income rounded to the nearest multiple of ten Rupees			
14	Income Tax payable on net Taxable Total Income			
15	Add : 4% ( Health & Education Cess)			
16	<b>Total Tax Payable (14+15)</b>			
	Tax Deduction up to <b>November - 2020</b>			
	Tax To be Deduction in <b>December - 2020</b>			
	Tax To be Deduction in <b>January - 2021</b>			
	Tax To be Deduction in <b>February- 2021</b>			
17	<b>TOTAL PAID TAX</b>			
18	<b>Tax Payable / Refundable (16-17)</b>	<b>(+)(-)</b>		

**CERTIFICATE**

Certified that the information regarding total income and deduction mentioned in the statement is correct as per Income-tax Act. ઉપરોક્ત માહિતી અને દેખાતી ગણતરી સાધનિક પુરાવા આધારીત કરવામાં આવેલ છે જે મારી જાણ મુજબ બરાબર છે અને ભવિષ્યમાં આ બાબતે આવકવેરા વિભાગમાંથી જો કોઈ નોટીસ આવશે અને જો નાણા/ પેનલ્ટી ભરવાની થશે તો તે ભરવાની હું બાંહેધરી આપું છું

હું વિકલ્પ-“A”-નવો વિકલ્પ      સ્વીકારવા સમંત હું      SIGNATURE:- \_\_\_\_\_

હું વિકલ્પ-“B”-જૂનો વિકલ્પ      સ્વીકારવા સમંત હું      SIGNATURE:- \_\_\_\_\_

Date :-

CHECKED BY

DDO

AUDIT OFFICER  
PAY & PENSION CELL